https://archive.org/details/bk1168/page/n0/mode/1up

1920-09 -Imam Mahendi Kyare Jaher Thashe (1168)

All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

ઈમામ મ્હેંદી–

ક્યારે

જાહેર થશે ?

પુષ્પ:—૨ જું

નકલ ૫૦૦.

છપાવનાર,

ઈ. ઈ. 'સ્નેહ મંડળ' (વરવા)

કિંમત ૦)– આનો.

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 5, 6.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v7.py

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.20 18:59:21 +05'30'

realpatidar.com

ઈમામ મ્હેંદી—

ક્યારે

જાહેર થશે ?

પ્રત ૫૦૦.

છપાવનાર,

ઈ. ઈ. 'સ્નેહ મંડળ' (વરધા)

કિંમત ૦)– આનો.

realpatidar.com

realpatidar.com

ગુજરાત વિદ્યાપીઠ ૧૯૨૦
અમદાવાદ
ગુજરાતી

બે બોલ.

ઈસ્માઈલી સતપંથ પ્રકાશ'ના માસ ભાદરવા ૧૯૭૬ ના અંકમાં 'ઈમામ મેંહદી ક્યારે જાહેર થશે.' નો લેખ વાંચતા અમોએ ધાર્યું કે એ લેખ આજના જમાનાને આબાદ લાગુ પડે છે અને તેથી આપણા ભાઈઓમાં તેનો વધુ ફેલાવો થાય એવા હેતુસર અમોએ તેને જુદા પેમ્ફલેટના રૂપમાં છપાવી બહાર પાડેલ છે.

અમો બાળકોએ સ્થાપેલ આ મંડળના આ પ્રથમ કાર્યને દીનબંધુઓ માનની નજરથી જોશે અને આ પેમ્ફલેટ વાંચી યોગ્ય સાર ગ્રહણ કરશે.

લી૦ શી. ઇ. ઈ. સ્નેહ મંડળના
મેમ્બરોના યા અલી વાંચશો.

Sept-1920

realpatidar.com

realpatidar.com

गूजरात विद्यापीठ ग्रंथालय

[गुजराती कॉपीराअिट विभाग]

अनुक्रमांक ૮૨૨૮ वर्गांक

पुस्तकनुं नाम ઇમામ મહેદી

विषय પ૭૨૬ : ૬

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n5/mode/1up

realpatidar.com

ઈમામ મ્હેંદી ક્યારે જાહેર થશે!

લખનાર:—રા૦ "હુદા."

દુનીયા ઉપરના મુખ્ય ધર્મવાળાઓ કબુલ કરે છે કે જ્યારે અધર્મનું જોર વધે છે, અને દુનીયામાં અન્યાય, જુલમ, દગાબાજી વીગેરેનો દઉર ગરમ હોય છે, ત્યારે એક મહાન અજીત વ્યકિત પ્રગટ થઈ એ શયતાની દઉર શોરનો જબરદસ્ત બળથી વિનાશ કરી ન્યાય, દયા, નીતિ, અને ધર્મ-થી દુનીયાને ભરી દે છે.

realpatidar.com

realpatidar.com

હિન્દુ સનાતનીઓ નીકલંકી ઇશ્વરને દશમા અવતાર પ્રગટ થવાની વાટ જુએ છે, જ્યારે ઇસાઇઓ હ૦ ઈસાની આવવાની તેમજ ઇસ્લામીઓ ઈમામ મ્હેદી આવવાની વાટ જુએ છે.

નકલંકીનો અર્થ કલંક રહીત અથવા કલંક રહીત કરનાર થાય છે, એટલે દુનીયા પર વધી ગયેલા અનીતિ, જુલમ અત્યાચાર રૂપી કલંક નાબુદ કરનારને નીકલંકી ગણીએ તો ભાવાર્થ જોતાં ખોટું નહી ગણાય.

મ્હેદીનો અર્થ હાદી અથવા હીદાયત કરનાર થાય છે, યાને દુનીયાને અધર્મ તરફથી વાળી ધર્મ તરફ વાળનાર થાય છે.

આ પ્રમાણે અર્થ જોતાં દુનીયામાં જ્યારે અનીતી અને અધર્મનું જોર અતી-

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n7/mode/1up

realpatidar.com

શય વધી પડશે ત્યારે એક એવો મહાન નર પેદા થશે જે અધર્મનો નાશ કરી ધર્મની સંસ્થાપના કરશે.

આ નર કોણ હશે? સનાતનીઓ તે નર શૂદ્ર જાતીમાં થશે એમ કહે છે એટલે મલેચ્છ કે જેઓને તેઓ શૂદ્ર ગણે છે, તેમાંથી પેદા થશે, એમ માને છે; મતલબ કે તેમની તે માન્યતા મુજબ તે નર ઇસ્લામી હશે, એવો અર્થ થઈ શકે છે, અને જ્યારે ઇસ્લામીઓ હ૦ મહેંદીના પ્રગટ થવાની વાટ જુવે છે, તો પછી તે બંને જુજવા રૂપે એકજ હો તો શક લઈ જવા જેવું નથી. ઇસ્લામીઓ હ૦ મહેંદીના જાહેર થવા પહેલાં હ૦ ઈસાના આવવાનું જણાવે છે, એટલે ટુંકમાં નીચેનો શ્લોક હ૦ મહેંદી માટે આબાદ લાગુ પડે છે કેઃ—

realpatidar.com

realpatidar.com

મલ્લાનામશનિર્નૃણાં નરવર: સ્ત્રીણાં
સ્મરો મુર્તિમાન,
ગોપાનાં સ્વજનોઽસતાં ક્ષિતિભુજાં
શાસ્તા સ્વપિત્રો: શિશુ: ।
મૃત્યુર્ભોજપતેર્વિરાડવિદુષાં તત્વં પરં
યોગિનામ
વૃષ્ણીનાં પરદેવતેતિ વિદિતો રંગ
ગત: સાગ્રજ: ॥

અર્થ:-શ્રી કૃષ્ણ જ્યારે પોતાના વડા બંધુ બળદેવની સાથે કંસની સનમુખ રંગ ભુમીપર દાખલ થયા. ત્યારે ભીન્ન ભીન્ન લોકોએ શ્રી કૃષ્ણને ભીન્ન ભીન્ન રૂપે જોયા હતા મલ્લોએ વજ્ર જેવા જોયા હતા, ઉત્તમ મનુષ્યોએ એક મહાત્મા જેવા જોયા હતા. મથુરાની સ્ત્રીઓએ મુર્તીમાન કામદેવ રૂપે

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n9/mode/1up

realpatidar.com

જોયા હતા, ગોવાળીયાઓએ પોતાના સગાંઓ રૂપે જોયા હતા, દુષ્ટ રાજાઓએ દંડ દેનાર રૂપે જોયા હતા. માતપીતાઓએ બાળક સ્વરૂપે જોયા હતા, ભોજપતી કંસે મૃત્યુ રૂપે જોયા હતા, મુર્ખોએ થોડાથી ખરડાએલા હોવાથી બીભત્સ રૂપે જોયા હતા, યોગીઓએ પરમતત્વ રૂપે જોયા હતા, અને યાદવોએ પરમદૈવત રૂપે જોયા હતા.

(ચન્દ્રકાન્ત ભા૦ ૨)

એ મુજબ જેવી રીતે જુદી જુદી પ્રકૃતીના માણસોને શ્રી કૃષ્ણ એકજ હોવા છતાં જુદા જુદા રૂપે જણાયા તે મુજબ **એકજ મહાન વ્યકિત** કે જે પ્રગટ થશે તે ક્રીશ્ચનોને **ક્રાઈસ્ટ** (હ૦ ઇસા) જેવા, ઇસ્લામીઓને **હ૦ મ્હેંદી** જેવી અને હીન્દુઓને **નકલંકી** જેવી અગર તો અન્ય ધર્મીઓને

realpatidar.com

realpatidar.com

પોતે વકી રાખતા હતા મહાન નર જેવી જણાશે.

એ મહાન વ્યક્તી જેને આપણે હ૦ ઈમામ મ્હેંદી ગણીશું, તેઓના પ્રગટ થયા પહેલાં અનેક નીશાનીઓ જણાશે કે જે માટે જુદા જુદા શાસ્ત્રો નીચે મુજબ જણાવે છે.

(૧) ગીતાની ભવિષ્ય વાણી.

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ
ભારત
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં
સૃજામ્યહમ ॥
(અ૦ ૪ શ્લોક ૭.)

અર્થઃ—જયારે જ્યારે ધર્મની પડતી

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n11/mode/1up

realpatidar.com

થાય છે અને અધર્મ વધે છે ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરૂં છું.

પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતામ ।
ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે ॥

(અ૦ ૪ શ્લોક ૮.)

અર્થઃ-સત પુરૂષોના રક્ષણાર્થે દુષ્ટ લોકોનો નાશ કરવા માટે અને ધર્મ સ્થાપના કરવા માટે યુગે યુગે હું જન્મ લઉં છું.

(૨) બાઇબલની ભવિષ્ય વાણી.

(૧૧) અને તે સમયે મહાન સરદાર મીકાયેલ જે તારા લોકોના પક્ષમાં ઉભો.

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n12/mode/1up

realpatidar.com

રહે છે, તે ખડા થશે, અને એવા સંકટનો સમય આવશે કે દેશ જાતી થઈ, ત્યારથી તે એ સમય સુધીમાં કદી આવ્યો નહતો.

(૧૨) અને જાગુકનું (દહનીયાંર્પણુ) દુર કરાશેને અને વેરાનકારક અમંગળ વસ્તુ ત્યાં રાખવામાં આવશે તે વખતથી એક હજાર બસેં અને નેવું (૧૨૯૦) દીવસ થશે.

(૧૩) જે વાટ જુએ છે તે એક હજાર ત્રણસેં ને પાંત્રીસ (૧૩૩૫) દીવસે આવવાનો છે, તેને ધન્ય છે.

(દાનેયલ.)

(૩) પાક કુરાને શરીફની ભવિષ્ય વાણી.

આયત—

વસતંએઆ, યવમયોના દિલ આનોહ-

realpatidar.com

realpatidar.com

યિમ, મકાનિન કરીબ, (૪૧)
યવમ યસ્ન ઉન રસયહુન વિલ્ હક્કે
જાલેકા યવ મુ ખોરૂન, (૪૨)
(સુરેકાફ આ૦ ૪૧-૪૨ મી)

અર્થ:-અને તે દીવસે સાંભળ, કે જે દીવસે અવાજ કરનાર પાસેની જગ્યાએથી પુકારી બોલાવશે. (૪૧)

અને જે દીવસે તેઓ સત્ય માટે અવાજ સાંભળશે કે આ જહુરનો દીવસ છે.

(૪) ઇસ્માઇલી ધર્મશાસ્ત્રની ભવિષ્ય વાણી.

પોરા આયા અલીશા તણા; ધરતી માંગે ભોગ.
એક મરે ખાંડે ને દુજા મરે રોગ.

* *

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n14/mode/1up

realpatidar.com

પીઠ પૃથવીનાં રાજા ઉથાપશે.
ત્યારે નજર કરે મોરો શાહ.

* *

અસવારી ટાંણુ આવશે,
ત્યારે થાશે એકજ વરણુ.

* *

ત્યારે વાતો મોટાની નહી માનશે,
એવો કલજુગ આવ્યો જોય.

* *

નાત પરનાતે થાશે નાતરાં,
ને ઘર સંપન હોય.

* *

અ.શાજી–હીન્દુ મુસલમાન સરવે એકઠા,
તે રૂપ કર્યા નારાયણજી,
સહુ કોઈ ઇયાં એ સાંભળે,
પણ ઓળખ્યા વીના અંધારા–હરી.

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n15/mode/1up

realpatidar.com

આશાજી–મસજીદ માંહે જઇ બાંગજ દેશે.
ઉનકે દીલ માંહે એસાજી,
રસુલ વીના જો નમાજ ગુજારે,
તે વેળા હોએસે અંધારા–હરી.
આશાજી–ફરમાન વેળામાંહે અમર આવ્યા,
તીનકુ વીચારી ચાલોજી,
ઇમામ પાત્ર જે કોઇ આવે,
તીનકુ સહી કરી માનો–હરી.

(૫) શેખશનોશીની ભવિષ્ય-વાણી.

"મંય દેખ રહા હું કે, નવ મુસ્લેમ ઇસાઇ સલતનકી ફઉજે મેંહદવી નીશાન કે નીચે જરમનસે લડ રહી હય."

(ભા૦ ૧ પાનું-૨૫ ઇસ. ૧:૧૨)

realpatidar.com

realpatidar.com

હવે મજકુર ભવિષ્ય વાણી આપણે આજે ખરી પડી જોઇએ છીએ, જેમકે ઉપર ગીતામાં જણાવવામાં આવેલ છે કે, "અધર્મનું જોર વધે છે, ત્યારે હું અવતાર ધારણ કરૂં છું" અત્યારે દુનીયામાં અધર્મને અનીતી એટલી પ્રસરી ગયેલ છે કે, નવીન ફાટતા રોગોનું કારણ બીજું કાંઈ નહી જણાવતા દુનીયામાં વધી પડેલ અનીતી અને અધર્મનું આપવામાં આવે છે, દુષ્ટ લોકો અત્યારે ફાવી જતા ધર્મી લોકો બીચારા રીબાય છે, ટુંકામાં ગીતામાં જણાવેલ સમય અત્યારે જણાય છે.

બાઈબલની ભવીષ્ય વાણી ૧૯૧૪ માં ફાટી નીકળેલ મહાન જંગનો ઇસારો કરે છે અને તે સમય મજકુર ભવીષ્ય વાણીમાં જણાવ્યા મુજબની ગણવામાં આવે છે, તે

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n17/mode/1up

realpatidar.com

વાતના ટેકામાં દાનીયેલની ભવીષ્ય વાણી-માં ૧૩૩૫ દીવસનો ઇસારો હી૦ સ૦ ની સાલ માટે છે કારણ કે જાથુનું દહનીયાપણ હ૦ મહમદ સ૦ ના વખતથી બંધ થયું છે, ત્યારથી એટલે ૧૩૩૫ વરસે જે થશે, તે મેહેંદી જાહુરને ધન્ય છે એમ બતાવે છે.

પાક કુરાને શરીફમાં સુરેકાફની આ-૪૧ જે ઉપર આપવામાં આવેલ છે તે જાહુરાત માટેના છે. અને તે આયતના અક્ષરોની અદદની ગણત્રી ૧૩૩૭ થાય છે એટલે કે તે ઇમામ મેહેંદીના જાહુરાતના વખત માટેનો ઇસારો છે.

હરમાહલી ધર્મશાસ્ત્રની પાંચસો વર્ષ પહેલાંની ભવીષ્ય વાણી ચાલુ જમાનાની

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n18/mode/1up

realpatidar.com

સ્થીતી આએહુબ ચીતરે છે. અને તે ઉપરથી ઇમામ મ્હેંદી કયારે જહુર થવા જોઇએ તે જણાય છે.

ટુંકમાં ઇમામ મ્હેંદીના જહુર થવાની નીશાનીઓ ચાલુ જમાનાને આબાદ લાગુ પડે છે. ઇસ્લામી આલેમો આ બાબત ખરી માને છે, અને ચાલુ જમાનાના શેર ફઉરને ઇમામ મ્હેંદી પ્રગટ થવા અગાઉની નીશાનીઓ તરીકે ગણે છે, સુન્નત જમાયતની કીતાબ "હલાએલુન્નોબુવ્વત" કે જે દીલ્હીના પ્રીન્ટીંગ વર્કસમાં છપાએલી છે. અને શાહ રફીઉદ્દીન સાહેબ મોહદ્દીસ દીલ્હીએ રચી છે. તેમાં કીઆમતની નીશાનીઓના પ્રકરણોમાં તેમનાજ આલીમો જેમકે "ઇમામ અહબલ હમ્બલ" "અબુ દાઉદ" અને "બહીકી"ના હવાલાથી ખરી

realpatidar.com

realpatidar.com

રવાયત લખી છે કે હ૦ સુબ્હાનલ રીવાયત છે કે હ૦ પયગમ્બર સ૦ મેં ફરમાવ્યું છે કે:—

"એક જમાનો એવો આવશે કે જેમાં ઇસ્લામી મુલકો કબજે કરવા માટે કાફરો એક બીજાને એવી રીતે દાઅવત આપશે કે જેવી રીતે સુફરા ઉપર જમવા માટે બોલાવે છે."

"આ સાંભળીને કોઇએ અરજ કરી કે "યા રસુલીલ્લાહ" શું તે વખતે અમો (મુસલમાનો) શું થોડી સંખ્યામાં હોઇશું?" ફરમાવ્યું કે "નહીં બલકે તમો તે વખતે ઘણા હશો પણ તમારી એવી હાલત હશે કે તમારૂં હોવું નકામું હશે, અને પાણીની રેલ સામે તણખલા હોય તેમ તમે હશો. દુશ્મ-નોની નજરોથી તમારો રોવાબ અને દબ-

realpatidar.com

realpatidar.com

ગમો ઉડી જશે, અને તમારા દીલ સુસ્ત થઈ જશે."

આ સાંભળીને એક અસહાબીએ અરજ કરી કે અમારા દીલ કેવી રીતે સુસ્ત બની જશે? આપે ફરમાવ્યું કે તમો દુનીયાને દોસ્ત રાખશો [નાણું! નાણું! માલ! માલ! કર્યા કરશો અને તે મેળવવામાં તમામ શકતીઓ લગાડશો] અને મરવાથી બીશો (મરવું નહીં ગમે.)

પછી એજ પ્રકરણમાં લખ્યું છે કે ઇસલામના વીરોધીઓ જે "કુસ્તુન્તુન્યા" (કોન્સ્ટાન્ટીનોપલ) એટલે ઇસ્તમબોલનો કબજો કરી લેશે, તેથી રૂમનો શહેનશાહ પાયતખ્ત મુકીને શામના દેશમાં ચાલ્યો જશે.

realpatidar.com

realpatidar.com

તો એવા વખતમાં હ૦ મ્હેંદી સ૦ જાહેર થઇને અમુક જરૂરતોથી ફારેક થઇને ઇસ્તમબોલને છોડવા માટે રવાના થશે, અને અહીરએ રૂમમાં પહોંચીને બનીઇસહાકના કબીલાના સીતેર હજાર શુરવીરોનો ફોજ તીઓ ઉપર સ્વાર કરીને ઇસ્તમબોલ છોડાવા લઇ જશે, તેઓ ઇસ્તમબોલની કીલ્લાની પાસે પહોંચશે ત્યારે 'અલ્લા હો અકબર'નો નાઅરો નાદ કરશે તેથી ખુદાના નામની બરકતથી એ કીલ્લો પડી જશે, તે વખતે મુસલમાનો એકદમ યાહોમ કરીને શહેરનો કબજો લઇ લેશે.

તો આ પેશનગાઇ (ભવિષ્ય વાણી) માં જે ચાર બાબતો ફરમાવી છે તેમાં ત્રણ બાબતો થઇ ચુકી છે. (૧) ઇસ્લામી મુલકના ભાગલા પડયા, (૨) ઇસ્લામીઓનો

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n22/mode/1up

realpatidar.com

શેઆબ ચાલ્યો ગયો, (૩) ઇસ્તમબોલ ઇસ્લા ' ઓના કબજામાંથી નીકળી ગયું અર્થાત સત્તા બીજાના હાથમાં ગઇ, હવે ફક્ત ચોથી બાબત બાકી છે કે ઇ૦ મ્હેંદી જાહેર થઇને તેનો પાછો કબજો લશે, તો જયારે આગળની એવા વખતની ભવીષ્ય વાણી એ હજરતની ખરી પડી કે આપે ફરમાવેલું કે કયસર અને કિસ્રા (ઇરાન વિ૦)નો કબજો ઇસ્લામ મેળવશે, અને બારે ખજાને. હાથ આવશે અને એ વખતે એ રાજય મહા બળવાન પુષ્કળ દોલતમંદ હતા. અને લશ્કર પણ ઘણું હતુ ઇસ્લામી ઘણા-જ થોડા હતા, તેમજ નાણાનુ બળ મોટા પ્રમાણમાં ન હતું, તો તે વખતે એ ભવીષ્ય વાણી ખરી પડવા વીશે ઘણાઓની અકલ કબુલ કરતી નહતી, છતાં એ ભવી-

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n23/mode/1up

realpatidar.com

ષ્ય વાણી સચોટ ખરી પડી, અને ઈરાનનો કબજો ઈસ્લામીઓએ લીધો. તેમજ આ છેલ્લા જમાનાની ઉપરની ચાર બાબતોમાંની ત્રણ બાબતોની ભવીષ્ય વાણી પણ ખરી પડી છે, ત્યારે હવે ચોથી બાબત કે હ૦ મ્હેંદી સ૦ જાહેર થઈને ઇસ્તમબોલનો કબજો લેશે તે શા માટે ખરી ન પડે? ઈન્સા અલ્લાહ જરૂર ખરી પાડશે.”

ત્યાર બાદ મજકુર માસીક જણાવે છે કે—“તે સાથે ખુશી થવાની એ બાબત છે કે જે આપણી રાજકરતી કોમ છે; તેમના ખુદા સમાન પયગમ્બર, હ૦ મ્હેંદી (અ૦) ની મદદ માટે તેમને તાબે રહીને ઇસ્લામી આલમની મદદ કરશે, ત્યારે આપણી રાજકરતી કોમ તો આપણી સાથે દુધમા સાકર મળે તેમ ભળી જવી જોઈએ.” તે બાદ તે જણાવે છે કે:—

realpatidar.com

realpatidar.com

''આ જે લખાણોમાંથી લીધું તેમાં એ સુન્ની બીરાદર છેવટે લખે છે કે એ ખોટા મ્હેંદી બનવા અને લોકોએ તપાસ કર્યા વીના તેમને માનવા ઇત્યાદીના ગુનાહના પરીણામે મહા ભારે મુશીબતો અને આફ-તોના ઘણા મુસલમાનો ભોગ થઇ પડયા છે, માટે એ જુઠા દાવેદારોને માનવાથી તોબાહ, કરે અને માફી ચાહે, કેમકે ખરા હ૦ **મ્હેંદીનો** ઝમાનો ઇસ્લામી મુલ્ક ગુમાવાનો નથી પણ આખી દુનીયામાં ઇસ્લામ સ્થાપ-વાનો ઝમાનો છે અને **ખરા મ્હેંદી** (શેખ કે મીરઝાં વી૦ નહી હોય) પણ **સયદ અવલાદ ફાતેમાહ** (અ૦) હશે"

ઉપર મુજબની આગાહીઓ અને ચાલુ જમાનાના મહાન કુદરતી ફેરફારો ઉપરથી આપણે જોઇ શકીએ છીએ કે ટુંક વખત-

realpatidar.com

realpatidar.com

માં ઈમામ મ્હેંદી જાહેર થશે ને ઈસ્લામ-ની રક્ષા કરશે.

ઉપર મુજબ જુદા જુદા ધર્મશાસ્ત્રો-ની આગાહીઓ અને હ૦ રસુલલ્લાહની હદીસ ઉપરથી ઈમામ મ્હેંદીની વાટ જોના-રાઓએ ઉંચા કાન અને સાફ નજર રાખી જોવું જોઈએ કે કદાચ ઈમામ મ્હેંદી જાહેર થઈ જાય અને તેઓ વાટ જોતાંજ રહે, ઉપર ઈસ્લામી માસીકનો વરતારો ઈમામ મ્હેંદીની વાટ જોનારાઓને ઈમામ મ્હેંદીની ઓળખ માટે સબક આપે છે કેઃ—

" ઈમામ મ્હેંદી, સય્યદે અવલાદે ફાતેમાહ અ૦ હશે. આપણી રાજકર્તા કોમ તેની મદદમાં હશે. અને તે ઈસ્લા-મી મુલ્કો માટે કોશેશ કરતો હશે અને

realpatidar.com

realpatidar.com

તે ત્યારે ખરી રીતે પ્રગટ થશે કે જ્યારે અમુક જરૂરતોથી ફારેગ થશે ”

ત્યારે હાલના જમાનામાં તેવો ઇસ્લામી નર કોણ છે? અને કુલ્લે દુનીયાના ઇસ્લામીઓની નજર કોના ઉપર તાકી રહી છે? એ પ્રશ્નનો ખુલાસો વાંચક વર્ગની વિચાર શકતી ઉપર છોડી આ મહત્વનો વિષય ખતમ કરૂં છું.

આમીન.

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n27/mode/1up

realpatidar.com

ઈસમાઈલી સતપંથ પ્રકાશ.

ધારમીક તથા સંસારીક બાબતો ચર્ચતું, ચાર વર્ષમાં લોકપ્રિય થયેલું માસીક દેશ પરદેશની આપણી જમાતની ખબરો પુરી પાડનારૂં આ એકનું એક વાજીંત્ર છે, ઉપરાંત વીધવીધ બાબતો ઉપર વીદ્વતા ભરેલા લેખો આપવામાં આવે છે આ માસીક દરેકે દરેક ઈસમાઈલીએ વાંચવા યોગ્ય છે. વારસીક લવાજમ પોસ્ટેજ સાથે હીંદુસ્તાન તથા મુંબઈના રૂા ૩, હીંદુસ્તાન બહારના દેશાવર માટે રૂ. ૪.

લખો:-

મુખી લાલજીભાઈ દેવરાજ.

ધી ખોજા સીંધી પ્રેસ, મુંબઈ નં ૯.

realpatidar.com

realpatidar.com

આ બુક મેનેજર વલીભાઇ નાનજીએ ધી
ખોજા સિંધી પ્રેસ, ૧૧૩ પાલખી
મહોલા, મુંબઇ, નંબર ૯ માં છાપી
અને શી. ઇ ઇ. સ્નેહ મંડળની
વતી એ૦ સે૦ મી૦ જુમા
ભાઈ જીવાએ વરધા
(બીરાર) માં પ્રગટ કરી.

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n29/mode/1up

realpatidar.com

"શીયા ઈમામી, ઈસ્માઈલી"

"સ્નેહ મંડળ."

માં નામ નોંધાવવા માટે સુચનાઓ.

(એ પેત્રન.)

આ મંડળમાં એ પેત્રનમાં નામ નખાવનાર પાસેથી દર માસ ૧) રૂપીઓ તથા નામ નોંધાવવા વખતે રૂપીઓ ૧૧ લેવામાં આવશે, મંડળ તરફથી છપાતી દરેક ચોપડીઓ નં, ૧૦ ભેટ મળશે.

(બી પેત્રન.)

નામ નખાવવા વખતે કંઇ પણ લેવામાં આવશે નહીં, નામ કઢાવવા વખતે ૧૧ રૂપીઓ લેવામાં આવશે, દર માસ આઠ આના, અને પાંચ બુકો ભેટ મળશે.

realpatidar.com

https://archive.org/details/bk1168/page/n30/mode/1up

realpatidar.com

“ શીયા ઇમામી, દરગાહીઓ

“સ્નેહ મંડળ.”

માં નામ નોંધાવનારા મેમ્બરોનાં ના

૧–ઓ૦ સેક્રેટરી, જુમાભાઇ જી

૨-મેનેજર, અબ્દુલભાઇ મામ

૩-ખજાનચી, અલ્લારખ્યા અલીભ

૪-મેમ્બર, ગુલામઅલી ખલ્ફાનભાઇ

(એડરેસ)

ખોજા જીવાભાઇ જમાલ,

C/O ખોજા જમાતખાના પાસે.

વરધા (બરાડ.)

Wardha C P.

realpatidar.com

realpatidar.com

-

realpatidar.com